

પુણા પો.સ્ટે. વિસ્તારની હદમાં પતિ પત્ની મોર્નિંગ વોક ઉપર નિકળેલ અને પતિએ પત્નીની હત્યા કરી અકસ્માતમાં ખપાવી દેવાના પુર્વનિયોજિત કાવતરાનો ભેદ ઉકેલી પતિ તથા અન્ય આરોપીને ઝડપી પાડતી સુરત શહેર કાઇમ બ્રાંચ.

તા.૦૮/૦૧/૨૦૨૧ ના રોજ પુણા પો.સ્ટે.ની હદ વિસ્તારના કુંભારીયા રઘુવીર સોલીયમ માર્કેટ નજીક મેઇન હાઇવેના સર્વિસ રોડ ઉપર વહેલી સવારમાં પતિ પત્ની મોર્નિંગ વોક માટે નિકળેલ હતા ત્યારે અજાણ્યા વાહનની અડફેટે પત્ની શાલીનીનું મોત થયું હતું આ બાબતે પતિ અનુજકુમાર સોહનસીંગ યાદવનાઓએ પુણા પો.સ્ટે.માં પુણા પો.સ્ટે. A-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૬૨૧૦૧૪૨ IPC કલમ ૩૦૪(અ), ૨૭૯ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબની ફરીયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.

આ એકિસડન્ટની ફરીયાદ બાબતે મરણ જનારના પિયર પક્ષ તરફથી શંકા વ્યક્ત કરવામાં આવેલી તેમજ કાઇમ બ્રાંચને પણ આ એકિસડન્ટનો બનાવ શંકાસ્પદ હોવાની ખાનગી હકિકત મળેલી જેથી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, નાઓની સુચનાથી પો.સબ.ઇન્સ. નાઓ તેમની ટીમના પોલીસ માણસો સાથે વર્ક આઉટમાં રોકાયેલ હતા દરમ્યાન પોલીસ અધિકારી/માણસોને મળેલ બાતમી હકિકત આધારે (૧) આરોપી અનુજકુમાર સોહનસીંગ યાદવ ઉ.વ.૨૭ ધંધો:-સિક્યુરીટીનો રહે. સારથી રેસીડેન્સી, ટાવર નં.એ/૧, ફ્લેટ નં.૨૦૧, સારોલીગામ, કુંભારીયા રોડ, પુણા, સુરત શહેર. મુળવતન:-કોચલાગામ, થાના:-મેરેચી, પોસ્ટ:-ઢેરામઇ તા.ઇટા જી.ઇટા યુ.પી. તથા (૨) મોહમંદ નઇમ ઉર્ફે પપ્પુ S/O મોહમંદ ઉસ્માન ઇસ્લામ ઉ.વ.૪૬ ધંધો:-વોચમેન રહે. પાલ પાટીયા R.T.O. ની બાજુમાં તાપી નદી કિનારે ખુદા કાસા ઝુપડામાં, પાલ, સુરત શહેર મુળવતન:-અશરહપુરગામ પોસ્ટ-મુસાફીરખાના થાના:-બલદીરાય તા.મુસાફીરખાના જિલ્લો:- સુલતાનપુર યુ.પી. નાઓની ઉડાણપુર્વક પુછપરછ દરમ્યાન આરોપી અનુજકુમાર યાદવને આજથી દોઢેક વર્ષ પહેલા મરણ જનાર પત્ની શાલીની યાદવ સાથે નજીવી બાબતે ઝઘડો તકરાર થયેલ તે બાબતે આરોપીએ તેમના પત્ની(મરણ જનાર) શાલીનીને મારી નાંખવાનું કાવતરું રચી સહ આરોપી મોહમંદ નઇમ ઉર્ફે પપ્પુ S/O મોહમંદ ઉસ્માન ઇસ્લામનો સંપર્ક કરી અનુજકુમાર યાદવ તેમજ તેની પત્ની બાબતેની તમામ ગતીવીધિથી વાકેફ કરી નઇમ ઉર્ફે પપ્પુએ મળી શાલીનીનું ગળુ દબાવી દિધેલ તેના કારણે શાલીની અર્ધબેભાન જેવી થઇ જતા પપ્પુએ ટ્રક ડ્રાઇવરને ટ્રક ચલાવવાનું કહેતા ટ્રક ડ્રાઇવરે ટ્રક ચલાવતા શાલીનીને તેના પતિએ ટ્રક નીચે ફેંકી હત્યા કરેલ હોવાની હકિકત પ્રાથમિક તપાસમાં મુલેલ છે. આમ, આરોપી અનુજકુમાર યાદવે સહ આરોપી નઇમ ઉર્ફે પપ્પુનાઓ સાથે મળી ખુનનો ગુનો એકિસડન્ટમાં ખપાવી દેવાના પુર્વનિયોજિત કાવતરાનો ભેદ ઉકેલી નાંખી પ્રશંસનિય કામગીરી કરેલ છે.